



### સીટી ઓફ બ્રેમ્પટને COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં વધારાના આરોગ્ય અને સુરક્ષા ઉપાયો શરૂ કર્યા

#### સીટી પ્રોવિન્સના નિર્દેશો અનુસરીને સુધારેલા સ્ટેજ 2 રિસ્કવરીમાં પ્રવેશ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 9, 2020) – પ્રોવિન્સની આજની ઘોષણા અનુસાર અને પીલ પબ્લિક હેલ્થની ભલામણો અનુસાર, સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 નો ફેલાવો ધીમો કરવામાં મદદ મેળવવા સુધારેલા સ્ટેજ 2 માં પ્રવેશી રહ્યું છે.

શનિવાર, ઓક્ટોબર 10, 2020 નાં રોજ સવારે 12:01 વાગ્યાથી અમલી બનતા, નીચેના આરોગ્ય અને સુરક્ષા ઉપાયો લઘુત્તમ 28 દિવસ સુધી અમલમાં રહેશે અને સતત તેની સમીક્ષા કરવામાં આવશે:

#### રેસ્ટોરન્ટ્સ, બાર્સ અને ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓ

શનિવાર, ઓક્ટોબર 10, 2020 નાં રોજ સવારે 12:01 વાગ્યાથી અમલી બનતી, રેસ્ટોરન્ટ્સ, બાર્સ અને ફૂડ કોર્ટ્સ સહિતની, ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓ, COVID-19 નો ફેલાવો કાબૂમાં લેવામાં મદદરૂપ થવા ઈનડોર ડાઈનિંગ સર્વિસીસ બંધ કરશે. ટેકઆઉટ (ટેક હોમ) અને આઉટડોર ડાઈનિંગની પરવાનગી હજી ચાલુ છે.

ઘણી રેસ્ટોરન્ટ્સ, બાર્સ અને ફૂડ કોર્ટ્સ સહિતની, ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓએ પીલ રહેવાસીઓને સંરક્ષણ આપવા પોતાની ધંધો કરવાની રીત પહેલેથી સ્વૈચ્છિક ધોરણે બદલવા એક નાગરિકલક્ષી પગલું ભર્યું છે ત્યારે, કાં તો પ્રોવિન્સની અથવા તો પીલ પબ્લિક હેલ્થની ભલામણોનું પાલન ન કરતા ધંધાઓ હેલ્થ પ્રોટેક્શન એન્ડ પ્રમોશન એક્ટ હેઠળ લુકમો મેળવવાને અધીન રહેશે.

સીટી ઓફ બ્રેમ્પટન ઉપલબ્ધ ટેકઆઉટ (ટેક હોમ) વિકલ્પોનો ઉપયોગ કરીને સ્થાનિક ખાદ્ય પદાર્થો વેચતી સંસ્થાઓને સહાયરૂપ થવા રહેવાસીઓને પ્રોત્સાહિત કરે છે.

#### બંધ થનારી વધારાની સગવડો

શનિવાર, ઓક્ટોબર 10, 2020 નાં રોજ સવારે 12:01 વાગ્યાથી અમલી બનતા, નીચેના સ્થળો બંધ કરવામાં આવશે:

- સીટીની રિક્રિએશન સગવડોમાં ફિટનેસ સગવડો સહિતના, ઈનડોર જીમ્સ અને ફિટનેસ સેન્ટર્સ (એટલે કે, કસરત વર્ગો અને વજન અને કસરત રૂમ્સ)
- સીટીની સગવડો સહિતના, પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર્સ અને સ્થળો
- કેસિનો, બિંગો હોલ્સ અને અન્ય ગેમ્સ એસ્ટાબ્લિશમેન્ટ્સ
- ઈનડોર સિનેમા
- રેસિંગ સ્થળોમાં પ્રેક્ષક વિસ્તારો
- પારસ્પરિક સંવાદની આપલે કરતા પ્રદર્શનો કે મ્યુઝિયમ્સ, ગેલેરીસ, જૂ, સાયન્સ સેન્ટર્સ, લેન્ડમાર્ક્સ વગેરેમાં અંગત સંપર્ક થવાનું ઉચ્ચ જોખમ ધરાવતા પ્રદર્શનો

#### ઘટાડેલી ક્ષમતા સીમાઓ

શનિવાર, ઓક્ટોબર 10, 2020 નાં રોજ સવારે 12:01 વાગ્યાથી અમલી બનતી, નીચેની ક્ષમતા સીમાઓ બંધ કરવામાં આવશે:

- પર્યટન અને માર્ગદર્શક સેવાઓ ઈનડોરમાં 10 લોકો સુધી અને આઉટડોરમાં 25 લોકો સુધી સીમિત
- રિયલ એસ્ટેટ ઓપન હાઉસીસ ઈનડોરમાં 10 લોકો સુધી સીમિત



- સ્કૂલ્સ, ચાઇલ્ડ કેર સેન્ટર્સ, યુનિવર્સિટીસ, એપ્લાઇડ આર્ટ્સ અને ટેકનોલોજીની કોલેજીસ, અને પ્રાઇવેટ કેરિયર કોલેજીસ માટે છૂટ સાથે, રૂબરૂમાં શિક્ષણ અને સૂચના ઈનડોરમાં 10 લોકો સુધી અને આઉટડોરમાં 25 લોકો સુધી સીમિત રહે છે
- મીટિંગ અને ઈવેન્ટ આયોજનો ઈનડોરમાં 10 લોકો સુધી અને આઉટડોરમાં 25 લોકો સુધી સીમિત
- ટીમ સ્પોર્ટ્સ માત્ર તાલીમ સત્રો સુધી સીમિત રહેશે (કોઈ રમતો કે ઝપાઝપી નહીં)
- આ વીકએન્ડ માટે પૂર્વ નિર્ધારિત વેડિંગ રિસેપ્શન્સ પ્રવર્તમાન જાહેર આરોગ્ય નિયમો અનુસાર થઈ શકે. મંગળવાર, ઓક્ટોબર 13, 2020 નાં રોજ સવારે 12:01 વાગ્યાથી અમલી બનતા, ઈવેન્ટ આયોજનોમાં ઈનડોર 10 લોકો સુધી અને આઉટડોર 25 લોકોની નવી ભેગા થવાની સીમાઓ સહિત, અદ્યતન જાહેર આરોગ્ય ઉપાયો વેડિંગ રિસેપ્શન્સને લાગુ થશે.

### સામાજિક હળવા-મળવાની સીમાઓ અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું

બ્રેમ્પટન અને સમગ્ર પીલ રીજીયનમાં તમામ સામાજિક મેળાવડા અને જાહેર આયોજનો ઈનડોરમાં 10 લોકો સુધી અને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવી શકાય ત્યાં આઉટડોરમાં 25 લોકો સુધી સીમિત રહે છે.

COVID-19 નું જોખમ ઘટાડવાના હેતુસર, પીલ પબ્લિક હેલ્થ અન્ય લોકો સાથે સંપર્ક ઘટાડવાની અને લોકો સાથે નાની સંખ્યામાં ભેગા થવાનું રાખવાની, અને સામાજિક વર્તુળો ત્વરિત ઘરબારના લોકો કે અનિવાર્ય સંભાળકર્તાઓ સુધી સીમિત રાખવાની ભલામણ કરે છે. આ થેન્ક્સગિવિંગ વીકએન્ડમાં, પીલ પબ્લિક હેલ્થ ઉજવણીઓ કરવાનું તમારા ત્વરિત ઘરબારના લોકો સુધી સીમિત રાખવાની ભલામણ કરે છે.

એકલા રહેતા કે પોતાના ત્વરિત ઘરબાર બહારના લોકો સાથે સંપર્ક ધરાવતા લોકો માટે, પીલ પબ્લિક હેલ્થ સંખ્યાબંધ વ્યક્તિઓ ભેગા થવાનું સીમિત રાખવા, એકબીજા સાથેનો સમય ઘટાડવા, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતરનું આચરણ કરવા, માર્ક્સ પહેરવા અને હાથ ધોવા પ્રોત્સાહિત કરે છે. જો બીમાર હો તો, રૂબરૂમાં ભેગા થવાને બદલે વર્ચુઅલી (આભાસીય) ભેગા થાવ, પરીક્ષણ કરાવો અને ઘરે પોતાને અલગ (સેલ્ફ-આઈસોલેટ) કરો.

બ્રેમ્પટન COVID-19 ઈમરજન્સી મેઝર્સ બાય-લો (કટોકટી ઉપાય પેટા-કાનૂન) હેઠળ, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર નિયમનનું પાલન ન કરતી વ્યક્તિઓને દરેક ગુના માટે લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 સુધીનો દંડ કરી શકાય છે.

પેટા-કાનૂન હેઠળ મ્યુનિસિપલ નિયમનો વર્ણવે છે કે:

- દરેક વ્યક્તિ દરેક બીજી વ્યક્તિથી ઓછામાં ઓછું 2.0 મીટરનું અંતર જાળવશે જ્યારે જાહેર મિલકતમાં હો, સિવાય કે વ્યક્તિઓ તે જ ઈમારતોમાં સાથે રહેતી હોય
- કોઈ પણ ધંધો પોતાના ધંધાની જગ્યામાં કે ધંધાની જગ્યા બહારની કોઈ વ્યક્તિને બીજી દરેક વ્યક્તિથી 2.0 મીટરથી ઓછાં અંતરમાં બેસવા કે ઊભા રહેવા દેશે નહિ, સિવાય કે વ્યક્તિઓ તે જ ઈમારતોમાં સાથે રહેતી હોય અથવા તે વ્યક્તિઓ તે ધંધાના કર્મચારીઓ હોય.

રહેવાસીઓ અને ધંધાઓ બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કોલ કરી શકે છે.

### મેન્ડેટરી ફેસ ક્વરિંગ્સ

મેન્ડેટરી ફેસ ક્વરિંગ્સ બાય-લો (ચહેરો અનિવાર્યપણે ઢાંકવાના પેટા-કાનૂન) હેઠળ, બ્રેમ્પટનમાં બધી ઈનડોર જાહેર જગ્યાઓમાં નોન-મેડિકલ માર્ક્સ કે ફેસ ક્વરિંગ્સ પહેરવા અનિવાર્ય બન્યા છે. જાહેર સંસ્થાઓ અને ધંધાઓએ પોતાના નિયંત્રણ હેઠળની ઈનડોર જાહેર જગ્યાઓમાં માર્ક્સ કે ફેસ ક્વરિંગ્સ પહેરવામાં આવતા હોવાની ખાતરી કરવી અનિવાર્ય બને છે.

આ બાય-લો (પેટા-કાનૂન) મુક્તિ આપે છે, તબીબી કારણોસર માર્ક કે ફેસ ક્વરિંગ ના પહેરી શકે તેવી વ્યક્તિઓ સહિતની ચોક્કસ વ્યક્તિઓને; બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને; અથવા કટોકટી હુકમો અનુસાર એથલેટિક (કસરતી) પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તમય રહેતી વ્યક્તિઓને. વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ: [www.brampton.ca/masks](http://www.brampton.ca/masks)



રહેવાસીઓ અને ધંધાઓ બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કોલ કરી શકે છે.

### COVID-19 ટેસ્ટ અને પરીક્ષણ સ્થળોની માહિતી

વ્યક્તિઓ ફાર્મસીસ અને એસેસમેન્ટ સેન્ટર્સ સહિત સમગ્ર પીલના સ્થળોમાં પરીક્ષણ કરાવી શકે છે. ગત મંગળવાર, ઓક્ટોબર 6 સુધીમાં, બધાં એસેસમેન્ટ સેન્ટર્સ અને પસંદગીની ફાર્મસીસમાં ટેસ્ટ કરાવવા એપોઈન્ટમેન્ટ્સ લેવી જરૂરી હતી. તમારો ટેસ્ટ બૂક કરાવવા એસેસમેન્ટ સેન્ટર કે ફાર્મસીનો સંપર્ક કરો.

પીલ અને બ્રેમ્પટનમાં COVID-19 પરીક્ષણ સ્થળોની યાદી માટે, પ્રોવિન્સની [વેબસાઈટ](#) જુઓ.

### બ્રેમ્પટનમાં વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ (Osler) ટેસ્ટિંગ

સાઉથ ફ્લેચરના સ્પોર્ટ્સપ્લેક્સમાં ઓસ્લરનું COVID-19 ટેસ્ટિંગ સેન્ટર

ઓસ્લર હવે COVID-19 ટેસ્ટ કરાવવાની પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિને ઓનલાઈન અને ફોન બુકિંગ કરવાની સગવડ આપી રહ્યું છે. બ્રેમ્પટનમાં સાઉથ ફ્લેચરના સ્પોર્ટ્સપ્લેક્સમાં ઓસ્લરનું COVID-19 ટેસ્ટિંગ સેન્ટર રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, અને એપોઈન્ટમેન્ટ્સ ઉપલબ્ધતા આધારે બુક કરવામાં આવે છે.

ઓસ્લરના COVID-19 ટેસ્ટિંગ સેન્ટરમાં ટેસ્ટ બુક કરાવવા, નીચેમાંથી એક વિકલ્પ પસંદ કરો.

- ઓનલાઈન: વેબસાઈટ જુઓ, [www.williamoslerhs.ca/coronavirus](http://www.williamoslerhs.ca/coronavirus)
- ફોન: 905.487.1249 નંબર પર કોલ કરો

સવારે 8:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી, અઠવાડિયામાં (બધાં) 7 દિવસોમાં.

કૃપા કરી નોંધી લેશો: ઓસ્લરે રૂબરૂમાં એપોઈન્ટમેન્ટ બુકિંગ બંધ કર્યું છે.

એકીકૃત આરોગ્ય અને સુખાકારી માટે પીલ મેમોરિયલ સેન્ટરમાં ઓસ્લરનું COVID-19, કોલ્ડ અને ફ્લૂ ક્લિનિક

ઓસ્લરના COVID-19, કોલ્ડ અને ફ્લૂ ક્લિનિક COVID-19 ટેસ્ટિંગ માપદંડો સંતોષતા દર્દીઓને, તેમજ લક્ષણો ધરાવતા અને તબીબને બતાવવા ઈચ્છતા દર્દીઓને, વોક-ઇન ધોરણે (એપોઈન્ટમેન્ટ વગર) મળવાનું ચાલુ રાખશે

બ્રેમ્પટનના સાઉથ ફ્લેચરના સ્પોર્ટ્સપ્લેક્સમાં અને પીલ મેમોરિયલ સેન્ટરમાં COVID-19, કોલ્ડ અને ફ્લૂ ક્લિનિક ટેસ્ટિંગ સેન્ટર પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, [www.williamoslerhs.ca/coronavirus](http://www.williamoslerhs.ca/coronavirus)

-30-

#### મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)



**BRAMPTON**

**Service and Information Update**

